

ત્વરિત જાહેરાત માટે

આ ઉનાળે બ્રેમ્પટન પ્રાઇડને (ગૌરવ) ઉજવે છે ઈવેન્ટ્સની વિસ્તરિત યાદી સાથે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (18 જૂન 2019) – રહેવાસીઓ અને મુલાકાતીઓને બ્રેમ્પટનના LGBTTIQ2SA સમુદાયને વધાવી લેવા માટે આ ઉનાળામાં ત્રણ ઈવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે, જે પૈકી બે તો પહેલી વખત જ આયોજિત થઈ રહ્યા છે.

આ વર્ષની પ્રાઇડની ઉજવણીઓની વિગતો આ મુજબ છે:

મેયર બ્રાઉન એન્ડ કાઉન્સિલ લવ ઈઝ લવ ઈઝ લવ પ્રાઇડ પરેડ પ્રેપ પાર્ટી (મેયર બ્રાઉન અને કાઉન્સિલ પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ પ્રાઇડ પરેડ પ્રેપ પાર્ટી) | જુન 22

અમારી સાથે શનિવારે, જુન 22ના રોજ બપોરે 2 થી 4 વચ્ચે પહેલવહેલી મેયર બ્રાઉન અને કાઉન્સિલ લવ ઈઝ લવ ઈઝ લવ પ્રાઇડ પરેડ પ્રેપ પાર્ટીમાં જોડાવ. આ પારિવારિક ઈવેન્ટમાં હશે ડીજે, નાસ્તાપાણી અને બલૂન કળાકારો. બીજે દિવસે રવિવારે, જુન 23ના રોજ ટોરોન્ટો પ્રાઇડ પરેડમાં લઈ જવા માટે બધાને બલૂનની કૃતિ બનાવવાનું આમંત્રણ છે. પાર્ટીનું પ્રાયોજન મેરિડિયન કેડિટ યુનિયન કરી રહ્યા છે.

હાજર રહેવા માટે [અહીં](#) રજિસ્ટર કરો.

મેયર બ્રાઉન અને કાઉન્સિલ સાથે ટોરોન્ટો પ્રાઇડ પરેડ | જુન 23

ટોરોન્ટો પ્રાઇડ પરેડમાં મેયર બ્રાઉન અને કાઉન્સિલ સાથે રહીને બ્રેમ્પટનનું પ્રતિનિધિત્વ કરો – ઉત્તર અમેરિકામાં જે સૌથી વિશાળ હશે – જે હશે સ્વતંત્રતા, અભિવ્યક્તિ, પ્રેમ અને સમજણના સન્માનમાં, રવિવારે, જુન 23નાં રોજ. મેયર અને કાઉન્સિલરોની પાછળ પ્રાથમિક કૂચના ભાગ બનવામાં જો તમને રસ હોય તો ગુલાબી શર્ટ પહેરશો અને ટેડ રોજર્સ વે અને બ્લૂર સ્ટ્રીટ પર મેયર અને કાઉન્સિલને બપોરે 1:15 વાગે મળશો.

સંપૂર્ણ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

પ્રાઇડ ઈન ઇ સ્ક્વેર | જુલાઈ 7

લગભગ બીજા વર્ષે, સીટી પ્રાઇડ ઈન ઇ સ્ક્વેરનું યજમાન બન્યું છે. રવિવારે જુન 7ના દિને બપોરે 2 થી રાત્રે 9 વાગ્યા સુધી ગાર્ડન સ્ક્વેરમાં અમારી સાથે જોડાવ અને કળા, અભિનય અને પારિવારિક પ્રોગ્રામિંગ મારફત પ્રાઇડને વધાવી લો. વિવિધ પ્રદર્શનકર્તાઓને બ્રાઉઝ કરો અને લાઈવ મનોરંજન માણો, જેમાં ભાગ લેશે ટૂ એટેચ્ડ (Too Attached) અને કળાકારો ફે એન્ડ ફ્લફી (Fay & Fluffy), ફ્લાય લેડી ડાઈ (Fly Lady Di) અને ક્વાર્ટરબેક (Quarterback). સાંજે 7 થી રાત્રે 9 સુધી રોઝ થિએટર પાટિઓ પર ડીજે ચિપ્પી નોનસ્ટોપ (DJ Chippy Nonstop) સાથેની આફ્ટર પાર્ટી બિલકુલ ચુકશો નહીં.

સંપૂર્ણ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

આ રોમાંચક ઈવેન્ટ્સની સંપૂર્ણ વિગતો માટે www.brampton.ca/prideની મુલાકાત લો.

ગ્રીન સિટી તરીકે શક્ય હોય ત્યારે અમે નિવાસીઓને બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ઉપયોગ કરવાનું આલ્વાન કરીએ છીએ. તમારા સફરનું આયોજન કરવા માટે www.bramptontransit.com ની મુલાકાત લો.

અવતરણ

"બ્રેમ્પટનનાં આ વર્ષનાં પ્રાર્થનાં ત્રણ ઈવેન્ટ્સ માટે હું બધાંને અમારી સાથે જોડાવા પ્રોત્સાહિત કરું છું. નવા નક્કોર બે ઈવેન્ટ્સ સાથેની અમારી પ્રાર્થના ઉજવણીઓ બિલકુલ જવા દેવાય એવી નથી. બ્રેમ્પટનના અમારા મોઝેઈક સમુદાયમાં લવ ઈઝ લવ ઈઝ લવ LGBTTIQQ2SA સમુદાયનાં એક મૂલ્યવાન સદસ્ય અથવા સમર્થક તરીકે હું બધાંને ખુલ્લામાં આવીને આપનું સમર્થન દાખવવા આમંત્રિત કરું છું.

- મેયર પેટ્રિક બ્રાઉન (*Mayor Patrick Brown*)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને ત્યાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે શેકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca